

June 14, 2024

ज्येष्ठ शुक्ल पक्ष, अष्टमी विक्रम संवत, २०८१

National Stock Exchange of India Limited

"Exchange Plaza"
Bandra – Kurla Complex,
Bandra (E), Mumbai – 400 051
NSE Code: GHCLTEXTIL

BSE Limited

Corporate Relationship Department, 1st Floor, New Trading Ring, Rotunda Building, P.J. Towers, Dalal Street, Fort, Mumbai – 400 001

BSE Code: 543918

Dear Sir/Madam,

<u>Sub: Filing of copy of newspaper advertisement for the notice of 4th Annual General meeting and remote e-voting information</u>

In continuance of our earlier communication dated May 27,2024, June 13, 2024 and pursuant to requirement of Regulation 30 of the Listing Regulations read with other applicable provisions, if any, please find enclosed herewith copy of newspaper advertisement released in the Hindu - Business Line (English) dated June 14, 2024, the Economics Times (English) - Ahmedabad edition dated June 14, 2024, and Financial Express (Gujarati) dated June 14 w.r.t. publication of the notice of the 4th Annual General Meeting of the Company and remote e-voting information.

Please note that copy of this intimation is also available on the website of BSE Limited (<u>www.bseindia.com/corporates</u>), National Stock Exchange of India Limited (<u>www.nseindia.com/corporates</u>) and website of the Company (<u>www.ghcltextiles.co.in</u>).

You are requested to kindly take note of the same.

Thanking you

Yours faithfully

For GHCL Textiles Limited



Lalit Narayan Dwivedi Company Secretary Membership No.:F10487

125.00 BS.00 BS.00

1100.00 450.00 875.00 250.00 60.00 375.00 7700.00 220.00 600.00 85.00 1500.00 1500.00 1150.00 1150.00 1150.00 1150.00 1150.00 1150.00 1150.00 1150.00

42.50

COMMODITIES 1509 No Sela New 1200.00 Basmati Common Br-8 1297.50 PR (11) SS.00 76.00 37.00 48.00 35.00 37.00 46.00 84.00 90.00 88.00 78.00 164.00 505.00 allers Order Services of Servi 71.25 71.50 118.00 88.00 73.00 80.00 65.00 52.00 106.00 129.00 137.00 E ROAL 83.00 71.50 71.25 150.00 92.00 116.73 97.00 132.00 120.00 66.00 128.00 79.00 46.00 42.00 215.00 174.00 42.00 46.00 34.00 120.00 165.50 24.50 39.00 34.00 44.00 49.00 37.00 24.00 21.00 25.50 34.00 35.00 30.50 36.00 32.00 Commodity Serat Varanasi Varanasi Varanasi Varanasi Varanasi Varanasi Waranasi Waranasi Waranasi Waranasi Waranasi Oranasi Office Bran O. Saranasi Maisa Bran Maisa Urrided Sega Close 580.00 517.00 530.00 530.00 532.00 74.00 81.00 395.00 312.00 363.00 425.00 305.00 295.00 CASHEW KER CASHEW KER CASHEW KER 188 No. 198 No. 219 No. 21 1060.00 750.00 1020.00 875.00 800.00 620.00 550.00 88.00 72.00 36.00 68850.00 72100.00 72450.00 MILK POWERS DELETED STATES AND ST Bar BJA Gold 585 BJA Gold 750 BJA Gold 916 BJA Gold 995 BJA Gold 999 Ornaments (22) 6400.00 2400.00 22.34 31.00 108.00 31.00 31.00 58.40 34.50 15.90 25.00 23.75 24.25 33.50 38.00 82.00 71.00 44.75 69.00 70.00 80.00 38.00 48.50 250.00 250.00 225.00 183.37 kgi 350.00 200.00 68.50 80.50 120.00 174.00 65.00 64.00 36.50 38.00 61.50 64.00 296.00 296.00 296.00 300.00 300.00 | Section | 1440 | Sect 145.00 175.00 28.00 30.00 30.00 30.00 32.00 31.25 27.50 23.00 g 95800.00 124.00 104.00 360.00 330.00 172.50 117.50 420.00 240.00 124.00 115.00 120.00 115.00 100.00 100.00 94.75 ICE ROAD 100.00 94.75 2600.00 3200.00 2400.00 1490.00 1535.00 2450.00 110.00 100.00 50.00 55.00 9 25.00 390.00 350.00 523.59 58.00 220.00 125.00 240.00 29.00 20.00 Hindray M.P. HYDERABAD Garli: (New) GINCER(1 Kg) DELHI Bangatore New HYDERABAD Ginger (New) KOLKATA Executors 300.00 285.00 205.00 220.00 285.00 125.00 220.00 825.00 382.50 400.00 800.00 57.00 148.00 94.00 30.00 105.00 64.00 64.00 570.00 95.00 HYDERABI Anv. Better Gourd Bottle Gourd Bottle Gourd Bringids Carboge Carrots Couliflower Custer Beans Doode French Beans Ridge Gourd Yam NON-FERROI ALUMINIUM(1 55.00 52.00 18.00 30.00 35.00 45.00 55.00 45.00 90.00 42.00 60.00 96.00 120.00 122.00 265.00 BOULES OF THE STATE OF THE STAT 184.00 238.00 258.00 242.00 218.00 186.00 222.00 1000.00 2550.00 1600.00 270.00 175.00 | Colored | Colo 79.00 127.50 9.20 12.50 130.00 150.00 593.00 241.00 187.00 99.60 19.00 19.00 17.00 17.00 17.00 17.00 ■ JALGAON 58.50 Kapas Desi (28/29MM) 68.50 ■ MUMBAI Corded Warps(40*1) 255.00 Corded Warps(40*1) 268.00 Corded Warps(60*1) 268.00 87.00 130.00 92.00 118.00 105.00 105.00 95.00 120.00 1125.00 1072.00 980.00 525.00 539.00 567.00 386.00 386.00 26.55 26.45 38.50 ICE ROAD 28.55 IRH 24.50 24.50 1056.00 AL(1 Kg) 1100.00 451.00 875.00 254.00 375.00 702.00 702.00 150.00 150.00 150.00 150.00 150.00 150.00 150.00 150.00 150.00 150.00 150.00 150.00 150.00 150.00 120.00 1 34.00 34.00 25.00 22.00 38.00 82.00 82.00 83.00 81.00 640.00 640.00 61.00 71.00 81.00 71.00 71.00 1170.00 108.00 880.00 880.00 1170.00 880.00 880.00 880.00 1170.00 880.00 80.00 80.00 80.00 80.00 80.00 80.00 80.00 80.00 80.0 533.00 570.00 535.00 68850.00 72100.00 72450.00 20.00 25.00 25.00 625.00 20.00 625.00 20.00 794.00 870.00 792.00 nembel Gurbandi CASHEW KEI. DELHI 160 No. 2 Process 2 Process 32 Process 32 No. 4 Process 8 Process 8 Process 8 Process 8 Process 8 Process 9 Pro 430.00 395.00 420.00 **ntal**) RTED PROUTS (1 Aug.) HI Stylaristan 80.00 ran 192.00 an (18 ligh 139.00 China is Ng.) 240.00 Thalland (1 kg) 600.00 Thalland (1 kg) 600.00 an (5 Kg) 180.00 b) (10 kg) 250.00 (Kg) 7 (1 kg) 250.00 (Thalland (10 kg) 250.00 nicion Thalland (11 kg) 800.00 nicion Thalland (1 kg) 48.00 55.00 823.00 843.00 834.00 770.00 34.00 38.00 39.50 27.00 22.E0 34.00 24.50 23.50 22.00 22.30 82.00 79.00 66.25 E ROAL 22.50 21.00 23.50 22.80 4700.00 (uintal) 575.00 580.00 440.00 510.00 610.00 580.00 250.00 250.00 193.00 1545.00 1540.00 1530.00 1520.00 1525.00 89200.00 87847.00 85700.00 88500.00 Maiss Bhar Maiss U.P. HYDERABAD Bajra. Jewir (Mhite) Javar (Nhite) Javar (Nhite) Maisre. KOLHAPUR Mich. Barrey Javar Maisre. Maisre-Papcom Muss.-Papcom Muss.-P ## CONTINUES | # 40.00 48.00 46.00 23.00 880.00 1520.00 190.00 150.00 77.00 70.00 (uintal) 1830.00 1780.00 1800.00 1200.00 44.50 **Kg)** Jaggery (Nize KOLKATA Batel Laddoo Batel Tin Chalus Gur MMUMBAI Batel-Sangli DELIHI Apagath Agagath Agagath Devband Devband Devband Devband Sinauri New Massana New Mod Shanii 51.50 45.00 55.00 272.00 210.00 269.00 265.00 268.00 231.00 238.00 195.00 195.00 192.00 245.00 960.00 225.00 1525.00 1740.00 485.00 40.00 68.00 1500.00 80.00 37.00 440.00 49.00 uintal) 95.00 248.00 200.00 180.00 37.00 39.00 35.00 Month Del Salan Man Del Salan 9.20 12.50 1000.00 2550.00 1800.00 3150.00 160.00 168.00 126.00 119.25 E ROAD nataka | COLUMN | C 00.00 88.00 78.00 37.00 48.00 37.00 40.00 144.00 90.00 90.00 104.00 104.00 50.00 Rss dingraded TEA 8 TEA(1 Kg) DELHI Assam Kchi Siliguri KOLKATA Daylelling Tea MUMBAI Assam bust Assam Mared South FISH & BROILER BROILER-KG(1 Kg) Anti-Batte Good Batter Good Ba 105.00 185.00 18.00 84.00 87.00 285.00 18.50 43.00 186.00 525.00 50 Cm) 400.00 220.00 300.00 112.50 162.50 112.00 100.00 119.00 170.00 58.40 34.50 15.90 25.00 23.75 24.30 44.50 22,00 47,00 47,00 52,00 53,00 146,00 660,00 127,50 280,00 66,00 177,50 280,00 66,00 177,50 280,00 66,00 177,50 145,50 177,50 185,00 177,50 285.00 325.00 240.00 180.00 280.00 385.00 470.00 395.00 310.00 250.00 180.00 120.00 165.50 275.00 250.00 150.00 FRUITS & VE 74.00 80.00 47.00 42.00 39.16 37.85 7050.00 7000.00 6950.00 6900.00 6600.00 42.00 47.00 35.00 775.00 830.00 735.00 1050.00 1200.00 200.00 137.50 1050.00 69.00 81.00 120.00 174.00 88.00 72.00 38.00 115.00 85.00 225.00 360.00 330.00 128.00 GHCL Limited Registered Office: GHCL House, Opp. Punjabi Hall, Navrangpura, Ahmedabad-38009 (Gujarat). Phone: 079-26427519. (CIN: L24100GJ1983PLC006513) Corporate Office: GHCL House, B-38, Institutional Area, Sector-1, Noida (UP). Ph. 0120-4939900. Email: ajhclinf@plch.co. in; secteriaria@plch.co. in; Website: www.ghcl.co. in

PSPCL Punjab State Power Corporation Limited

(Regd. Office : PSEB Head Office, The Mall, Patiala-147001 Corporate identity Number : U40109PB2010SG033813 Website : www.pspcl.in Mobile No. 96461-55525 Short Term E-Tender Enq. No. 7558/P-3/EMP-12668 date

11.05.24

Dy, Chief Engineer/ Headquarter (Procurement Cell-3)
GGSSTP, Roopnagar invites E-Tender ID No.
2024 POWER, 121985 I for Procurement of ESP Rapping
System. For detailed NIT & Tender Specification please refer to

onwards.

Note: - Corrigendum & addendum, if any will be published onlin
at https://eproc.punjab.gov.in

RTP-4624, DPRPb. 76155/12/28462023/04544

Among the Village ANAND Ta. & Dist. Anand, bearing R.S.No.1226/3/2 Paikee+1226/4+1226/5 Paikee, which is total adm. H.O-25-80 ARE paikee Southern Side 1468.00 total adm. H-U-25-90 ARt: paixee Southern Side 1465.0U Sq.mt. land in situated residential plots namely NARYAN BUNGLOWS, that bunglows paikee Sub Plot No.8/B, which is total adm.146.75 sq.mtr. land purchased by MANISHABERN BHARATBHAI PATEL from its owner MUKESHBHAI JAYANTBHAI PATEL form its owner MUKESHBHAI JAYANTBHAI PATEL by Registered sale deed No.7460/2006 dated 18/12/2006 before Sub Registrar of Anand. That original sale deed has head has been lost somewhere, due to default by my client. deed has been lost somewhere due to default by my client, which cannot be found despite much search. And if found inform

which cannot be round despite much search, and if tound inform us about it and do not misuse it any way, and especially if any person, organization, Bank, Govt. Semi Govt. must be informed.

THIROUGH ME RAJESH R. PRAJAPATI, ADVOCATE
OFFICE: F/4, CHADA ESTATE, OPP. JILLA SEVASADAN.
ANAND - 388003, Mo. NO. 9624820136 (2) 8780121302

NOTICE OF 41ST ANNUAL GENERAL MEETING AND REMOTE E-VOTING INFORMATION

In continuation of our previous adversionem published on May D KLANUTE E-VOTHIS IN PURMATION IN continuation of our previous adversionem published on May 27, 2024, we herely issue a NOTICE to inform you that if st.Annual General Meeting of the members of GHCL Limited (GNL 24100.21983PL C006513) will be held on Monday, July 9, 2024 (reherer, server, year vs — grifts, fress views vs.cv) a 10.00 a.m. (IST) via video conference (VC) and other audio visual means (OAVM).

In accordance with the circularis issued by the Ministry of Corporate Affairs (MCA) and the Sociation server of the Common server. Therefore, our Company has opted to held the AGM via VC to discuss and transact the business outlined in the Notice of AGM dated May 6, 2024.

In compliance with the circulars, we have electronically sent the notice of the 41st AGM and the Integrated Annual Report of Our Company of the financial year 2022-21 to all members whose emila addresses are registered with the Company of the propository Participants. These documents are also accessible on our company's website (www.pdc.co.hi), as well as on the websites of SSE Limited (www.pdc.cohi, as well as on the websites of SSE Limited (www.pdc.cohi, or the AGM 2014-001 was mail was the Company of Deposite Company

Company or Depository Participants. Insee outcomment of the Company of Depository Participants. Insee outcomment of Depository Participants. Insee outcomment of Depository Depositors of Depository Depositors of D

and no further changes to the cast votes will be allowed.

Additionally, members attending the meeting will have the option to vote through the electronic voting system during the AGM. Those who have already cast their votes through remote e-voting will be able to attend the meeting but will not be eligible to vote again. Detailed instructions for members regarding remote e-voting were provided in AGM Notice and the newspaper advertisement published in May 27, 2024.

If you have any queries or issues regarding e-voting, we have provided resources to assist you. You can refer to the Frequently Asked Questions (FACs) and e-voting manual available at www.evotingindia.com under the help section. Additionally, you can reach out for support by sending an email to helpdesk.evotingidiad.com under the help section. Additionally, you can reach out for support by sending an email to helpdesk.evotingidiad.com under the help section. Additionally, you can reach out for support by sending an email to helpdesk.evotingidiad.com under the help section. Additionally, you can reach out for support by sending an email to helpdesk.evotingidiad.com under the help section. Additionally, you can reach out for support by sending an email to helpdesk.evotingidiad.com under the help section. Additionally, you can reach out for support by sending an email to helpdesk.evotingidiad.com under the help section. Additionally, you can reach out for support by sending an email to helpdesk.evotingidiad.com under the help section. Additionally you can reach out for support by sending and sending the sending and the sending

For any grievances related to electronic voting, you can contact to Mr. Ganapati Haligouda, C-101, 247 Park, L.B.S. Marg, Vikhroli (W), Mumbai-400083, Tel. 8108116767, Fax: 022-49186060, Email: mt.helpdesk@linkintime.co.in. We kindly request that you send your queries at least seven days in advance of the meeting to ensure that the information can be made available and addressed during the meeting.

Your engagement and participation are highly valued, and we are here to provide assistance and support throughout the e-voling process.

For GHCL Limited Bhuwneshwar Mishra VP - Sustainability & Company Secretary

GHCL Textiles Limited

Registered Office: GHCL House, Opp. Punjabi Hall, Navrangpura (Gujarat). Phone: 079-26427519. (CIN: L18101GJ2020PLC114004 Corporate Office: GHCL House, B-38, Institutional Area, Sector-1, N

NOTICE OF 4TH ANNUAL GENERAL MEETING AND REMOTE E-VOTING INFORMATION

n confinuation of our previous advertisement published on May 27,2024, we hereby issue a NOTICE to inform you th he 4th Annual General Meeting (AGM) of the Company will be held on **Monday, July 08, 2024 (संभवार, अरापर, गुस्त प** – वृतीया, विक्रम संस्व २०११) at **12.30 P.M.** (IST) through Video Conferencing (VC) or Other Audio-Visual Means (OAVM).

— effert, Rissa-kies excey at 12.30 PM, (157) through Video Conferencing (VC) or Other Audio-Visual Means (OAMA). In accordance with the circular issued by the Ministry of Corporate Affairs (MCA) and the Securities and Exchange Board of India (SEBI), companies are permitted to conduct AGMs through VCI OAMA without the physical presence of members at a common venue. Therefore, our Company has opted to hold the AGM via VC to discuss and transact the business outlined in the Notice of AGM dated May 06.2024.
In compliance with the circulars, we have electronically sent the notice of the 4th AGM and the Annual Report of the Company for the financial year 2023-24 to all the members whose email addresses are registered with the Company or Oppository Participants. These documents are also accessible on our company's website (www.gleichelds.com).
Value of the Company of the website of SES Limited (www.gleiche.com), National Stock Exchange of India Limited (www.gleiche.com).
The dispatch of the AGM motion via email was completed on Julian 12.2024.

(www.nsinigia.com), and CDSL (www.evolingindia.com). The dispatch of the AGM notice wis email was completed on June 13, 2024.

As per the cut-off date, which is July 61, 2024 (Monday), the voting rights of the members will be determined based on their shares in the paid-up equity share capital of the Company. To facilitate the voting process, Central Depository Services Limited (CDSL) will provide the option for members to cast their votes through an electronic oving system, nown as "remote e-voring." The Notice of the AGM indicates information on the process and procedure for remote a-voting, a seal as enstructions for participating in the AGM information process procedure for remote a-voting, a seal as enstructions for participating in the AGM information or the process and procedure for the AGM indicates information on the process and procedure and the capital and the process and procedure and the capital and the process and procedure and the capital and the process and procedure and the process and procedure and the capital and the process and procedure and the capital and the process and the pr

between IOV0 a.m. to 8.30 p.m. from Monday to heady or heady of the for any grievances related to electronic voting, you can contact to Mr. Ganapati Haligouda mtheologica@inlomine.co.p or reach out to Link limite india Private Limited at the following address: C-101, Park, L. S. Many, Wirvine (West) Mulmand—ACORSS, Tai-C249185000.

We kindly request that by us send your quaries at least seven days in advance of the melting to ensure that information can be made available and addressed during the meeting. Provide assistance and support through the a-voting process.

For GHCL Textiles Limited Lalit Narayan Dwivedi Company Secretary (Membership No. F10487)

ઇનિશિયલ પબ્લિક આંકોરિંગ થતો હતો.
(આઇપીઓ) બહાર પાડવા આ ઉપરાંત તેણે લેઈ-સ અંગે વિચારણા કરી રહ્યાં છે. એન્ડ કંપની અને તેમાસેક એક મેકરને વિદેશી હોલ્ડિંગ્ઝ પ્રાઈવેટ લિપિટેડની રોકાણકારોને વેચવાની આગોવાનો હેઠળના અન્ય એક પોજના ખોર્સ્સ હોલો ચૂપ પાસેથી પણ બિડ્ડ પ્રેળવી પગલે આમ કરવામાં આવી હોવાનો અહેવાલમાં દાવો રહ્યું હોવાનું બ્લુપાર્ગ્ય સૂત્રોને કરવામાં આવ્યો હતાં.

અભજ ડોલસ્થા ૮.પ પહેં-ડેઇના દાવકામાં ગંગા અભજ ડોલસ્તા બિડ્ડ આશકે બિશન અગદ્યાલ દ્વારા ૧૨ અભજ ડોલસ્ના તેના કરવામાં આવી હતી અને તે મૃશ્યાંકનની અપેક્ષાઓને ન મીઠાઈ અને નમકીનઘી માંડીને સંતોપતી હોંવાથી અગદ્યાલ વિધિય પ્રકારનાં એક્સ અને પરિવાર આઈપીઓ અંગે ફ્રોઝન મિલ્સ સહિતની ખાદ્ય વિચારણા કરી રહ્યો હોવાનું ચીજોનું વેચાણ કરે અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે. હતું. કંપનીની વેબસાઈટમાં

એક્ક બ્યૂરો કહેક બ્યૂરો કહેક બ્યૂરો કહેક બ્યૂરો કહેક બ્યૂરો કહેક બ્યૂરો કહેક પ્રાઈવેટ કન્સોર્ટિયમ પાસે બિડ્ડઝ સિમિટેડની માલિકો ધરાવતાં મેળવી હતી. કન્સોર્ટિયમમાં અગાવતાલ પરિવાર કુંક અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ પ્રોડ્રયુમર અને રેસ્ટોસ્ન્ટ ઓથોરિટી તથા જીઆઈસી ઓપરેટર માટે સંબંધિત પ્રાઈવેટ લિમિટેડનો સમાવેલા ઈન્યિયલ પબ્લિક ઓફારિંગ ધાતે હતો.

ટાંકતાં જણાવ્યું હતું. હલ્દીરામની સ્થાપના ૮ અબજ ડોલરથી ૮.૫ ૧૯૩૦ના દાયકામાં ગંગા

હતુ. કપનાના વખસાઇટના અગાઉ, જણાવવામાં જણાવ્યા મુજબ, તે ૪૩ આવ્યું હતું કે, હલ્દીરામ્સે મેમાં રેસ્ટોરન્ટ્સ પણ ચલાવે છે.

જેવાં કે પ્રાથમ કે પ્રકાશ કરવાના અને વિજે હિલ્લો કરેલા અંગે માના સિનીની માર્ટિકોની મોટી સ્વ તો, સ્વ., ૧૯૩૧ તો પર માર્ચ પ્રવાદ માર્ચ પ્રાથમ કરેલા કરેલા કરતા પણ પ્રવાદ મોટી પાંચી વાર્ષિક પ્રાથમ કરતા (પેડ્રુપોમ) કોળવા, પૂજાઈ ત., ૧૯૩૧ (લેજ્વા, ૧૦૧૩, ૧૯૦૧) તેનું તેનું કે તેનુ કે તેનું કે તે તેનું કે ત

પ્રાસખ્ય કરાવલ છ. સભાસદોને ઈ-વોર્ટીંગને લગલી કોઈ પૂછપરછ અથવા સભરવાઓ કે ફરિયાદો ક્ષેય તો અમે તેના નિવારાત્ર માટે તમને અમે મદદ પૂદી પાકીશું, assential ને -વીઇમન વનની કંઈ ગુમ્પાય અંપના કરાવામાં કે હવિનારી કંપ તે પર્વ ને વેતા ને પાત્ર પૂર્વ પાત્રિયું.
sential તેના હિંદુમાં સ્વાર્થ્ય લોકો કહે એ વાંતુ માં પ્રત્ય કર્યા હતી.
જે અમાર વેતાના કુળામું લાંદી કહે એ તે ને -વીઇમ પૂર્વ પાંચી શકે એ વાંતુ લાંદા કહે એ વાંતુ ને અના તેના હિંદુ મહત્વ પાત્રી કહે. આ તેના તેના કર્યા હતી.
જે એક એ તે ને -વીઇમ મેનુલ પાંચી શકે એ વાંતુ લાંદા કાર્ય કંપ શકે છે. કારાવાને અને ક્લિય દિવાર પાત્ર કંપના કંપન

જીએચસીએલ લિમીટેક

રજી. એફિશ : જીએસરીએલ કાઉસ, પંજાબી ફોલ સાચે, નવરંબપુ Phone: 078-28427318. (CIN: L24100GJ1983PLC008513) કોપોરિટ એફિશ : જીએસરીએલ કાઉસ, બી-3૮, ઇન્સ્ટીટપુશનલ

આપનાં આ માર્કતીને અને સાભા દરમાન ઉપલબ્ધ રાવધીને તેની વ્યૂઆત કરી શકાય. 'ત્રો આપનું જોડારા અને સક્ષ્મોળ અમારા માટે ખૂબ જ મુલવાન છે અને અને સમગ્ર ઈ-વોર્ટીંગ પ્રક્રીયા દરમ્યાન તમને માર્ગદર્શન અ સક્ષ્મીન પૂરો પાઠવામાટે ઉપલબ્ધ રહીશું.

Date of allotment	No. of Equity Shares	Pace value per Equity Share (₹)	Equity Share (₹)	Nature of allotment	Nature of consideration	Total Consideration (in F Million)
			Primar	y lasuancee		
June 23, 2023	14,742,048	2.00	NA	Borrus Issue of Equity Shares in the ratio of 2 Equity Shares for every 5 Equity Shares	NA	NI
Weighted as	Weighted average cost of acquisition (WACA) (primary issuances)(₹ per Equity Shere)					
			Secondar	y transactions		
				None		
Weighted everage cost of acquisition (WACA) (secondary transactions) (7 per Equity Share)						Not Applicable
				age cost of acquisition at which the equity a to nominate directors are disclosed below:	harea were less	ed by our Company, o

Justification for Basis of Office price

Detailed explanation for Differ Price Scieng with our Company's KPis and financial ratios for the periods presented in the Resistant Prices sking with our Company's KPis and financial ratios for the periods presented in the Resistant Prices along with our Company's KPis and financial ratios for the periods presented in the Resistant Prices of the states in the ratio of the states in the ratio of the states in the ratio of the states of the resistant in the ratio of the resistant in the ratio of the states of the resistant in the ratio of the resistant in resistant in the ratio of the resistant in resistant in

Not Applicable
Not Ap

ASBA* Simple, Safe, Smart way of Application!!! Update the safe of the process of the safe of the safe

"Applications Supported by Bocked Amount
("ASBA") Is a bottor way of applying to offers by
simply blocking the fund in the bank account.
For further details, check section on ASBA.
Mandatory in public issues.
No cheque will be accepted.

AXIS CAPITAL

Aria Capital Libritud
11 Floor, Aria House
12 House Aria House
12 House Aria House
13 House Aria House
14 House Aria House
15 House Aria House
15 House Aria House
16 House
1

JM FINANCIAL

Jan Financia Limited
7 Flox, Constg.
Appeache Menthe Marg
Problement, Menthe Marg
Problement, Menthe Mol O 25
Metamathin, India
Tel: +91 42 6830 9830
Fenall: state-priviletyles. (so@)
Invasion grievance & e-mil.
grievance. & de@)Inf. com
Weisstate: www.jmf. com
Contact Person: Prache both
SEBI Registration No.: INMO

O SBICAPS

▲ KFINTECH

For STANLEY LIFESTYLES LIMITED On behalf of the Board of Directors

QUICKLY.

Samsung partners with Paytm for Wallet services



Samsung has launched flight, bus, movie and events ticket bookings on Samsung Wallet, in partnership with One97 Communications which owns the Paytm brand. The tie-up aims to offer seamless, integrated booking experience directly through the Samsung Wallet, facilitating access to a wide range of services through Paytm.

Aurionpro gets RBI nod for online payment aggregation

New Delhi: Aurionpro Payment Solutions on Thursday said it has received Reserve Bank's nod to operate as an online payment aggregator via its payment gateway brand AuroPay. The authorisation from the apex bank enables the company to operate as an online payment aggregator to provide digital payments services to merchants across the

NBFCs eye overseas fundraise as RBI tightens regulations on banks

CHARTING A NEW PATH. Cholamandalam leads the pack rising \$200 million followed by REC, Bajaj Finance

Suresh P Iyengar

Non-banking Finance Companies (NBFCs) will soon explore overseas market for fund raising with RBI restricting banks investment in them as a pre-caution on the back of run-away credit off-take.

In fact, some of the toprated NBFCs have already starting tapping into the ECB market. Among them, Cholamandalam Investment & Finance raised the highest amount \$200 million followed by REC and Bajaj Finance fund raise of \$147.9 million and \$125 million in March quarter.

Muthoot Microfin recently announced closure of its \$113 million fund raise through ECB route.

OVERSEAS BORROWING With the expected cut in US Fed rate looming, NBFCs

have started increasing bor-

rowing overseas after their

FINANCE WITHOUT BORDERS. Experts say overseas borrowing by highly rated NBFCs will grow because hedging costs are low and global interest rates are on softening bias

cost of capital went up following the RBI decision to raise their risk weightage. Overseas borrowing will help NBFCs to meet their funding requirement amid high credit demand, said a

senior bank official. Overseas borrowing by highly rated NBFCs will grow because hedging costs were low and global interest rates are on softening bias, he added.

Nikunj Saraf, Vice President, Choice Wealth, said RBI has adopted a stricter approach to credit disbursement by banks, particularly regarding NBFCs and this cautious stance stems from concern on potential systemic risk in the financial system. While NBFCs are actively seeking to tap cheaper foreign markets for funds requires, they have to develop robust foreign currency risk management strategies, he added.

Despite these challenges, macroeconomic structure necessitates credit expansion as the nation strives to become the world's third-largest economy and this inherent growth trajectory will continue to fuel demand for NBFC lending services, Saraf said.

ICRA projects growth in the NBFC sector will moderate, especially in the nonmortgage retail loan segment, on back of expanded assets under management following the high growth rates seen in the past two fiscal years. The personal and consumption loan segments, which grew at steep rate in the previous two fiscal years, will experience relatively muted growth in the current fiscal year in light of regulatory actions on such loans.

MUTED GROWTH

The AUM of NBFCs (excluding housing finance companies and infrastructure finance companies) may grow at a relatively muted but healthy rate of 19 per cent in this fiscal against about 24 per cent in last two fiscals. Companies' asset quality and earnings may weaken with non-performing assets increasing by up to 30 basis points from March and earnings declining 20-40 basis points from FY'24, as growth slows and the expectation of tighter liquidity keeps cost of funds elevated.

Growth rates for HFCs and infrastructure NBFC will moderate to 14 per cent and 12 per cent in this fiscal. These companies may face relatively limited pressure on their loan quality and earnings compared to their peers, said ICRA.

G-Sec yields thaw, tracking fall in US Treasury yields

Our Bureau

Government Securities (G-Secs) yields thawed on Thursday, tracking substantial decline in the US Treasury yields, with yield of the benchmark 10-year paper closing below 7 per cent.

Unexpected drop in inflation in May triggered the drop in US Treasury yields even the US Fed held rates steady, dropping hints it may go in for only one rate cut in 2024 instead of three forecast earlier.

Yield of the 1he 10-year benchmark G-Sec (7.10 per cent 2034 GS) softened 3 basis points to end at 6.99 per cent against previous close of 7.02 per cent. Price of this security was up about paise, ending ₹100.7775.

"10Y benchmark (7.10 GS 2034) opened lower at 6.98 per cent, tracking a sharp fall in treasury yields overnight (following euphoria around softer US CPI inflation).



"Yields were ranged for the rest of the day in absence of fresh cues, with uncertainty around FOMC meeting outcome over," Nuvama said in a report.

Sharp moves in India yields were limited on hawkishly received FOMC outcome, wherein the committee revised its dot-plot lower — indicating one rate cut this year, it added.

Marzban Irani, CIO-Fixed Income, LIC Mutual Fund, said: "India's macroeconomic indicators are in a sweet spot. The 10-year benchmark paper is expected to trade in the 6.95-7.10 per cent range."

Banks' deposit accretion outpaces loan disbursals in fortnight-ended May 31

Our Bureau

With the credit cycle entering lean season, the banking system seems to be seeing more deposit accretion than loan disbursements, going by latest RBI data.

Typically, the first two quarters are considered lean for credit offtake as monsoon tends weigh on some of the segments of economic activity such as construction, fishing and allied activ-

Moreover, Government spending is expected to pick up only after Finance Minister Nirmala Sitharaman presents "NDA 3.0" government's first budget next month. This, in turn, could trigger credit demand from tne private sector.

In the fortnight ended May 31, all scheduled banks reported net deposit growth of ₹2,71,456 crore against net credit offtake of ₹1,81,386 crore, per RBI data on "Scheduled Banks' Statement of Position in India".

THE GAP CONTINUES

The Bank system has seen a mismatch in the credit and deposit growth in the last one year or so, with credit growth outpacing deposit growth. This has prompted banks to raise deposit rates to attract deposits.

In his last monetary policy statement, RBI Governor Shaktikanta Das, said: "The persisting gap between

The banking system has seen a mismatch in the credit and deposit growth in the last one year or so, with credit growth outpacing

deposit growth. This has prompted banks to raise rates to attract deposits.

credit and deposit growth rates warrants a rethink by the Boards of banks to restrategise their business plans. A prudent balance between assets and liabilities has to be maintained."

GROWTH CONCERNS

Das noted that in November last year, RBI had flagged certain concerns on excessive growth in the unsecured retail loans and over-reliance of NBFCs on bank funding. Recent data suggests that there is some moderation in these loans and advances.

"We are closely monitoring the incoming data to ascertain if further measures are necessary. The Boards and top management of regulated entities should ensure that risk limits and exposures for each line of business are kept well within their respective risk appetite framework," the Governor

Government of Kerala Published Tenders from 10-06-2024 to 12-06-2024

State Water Transport Department Tender ID: 2024_SWTD_675219_1 * DIRECTOR SWTD * Purchase of marine diesel engine with gearbox * Closing Date: 10-Jul-2024 * PAC: Rs4400000

Visit https://etenders.kerala.gov.in for more details. Ro.No:10-12/Jun/2024/PRD/(N)10



Corporate Contracts Department)
Sahar Receiving Station, Near Hotel Leela, Andheri (E), Mumbai 400 059, Maharashtra, India
(Board Line: 022-67173188) CIN: L28920MH1919PLC000567

NOTICE INVITING EXPRESSION OF INTEREST The Tata Power Company Limited hereby invites Expression of Interest from eligible parties for "Construction of Biodiversity Research Development and Training Centre at Walwhan, Lonavala, Maharashtra (Tender Ref. No.: CC25PMR013)"

Echravital, manifestional relations requirements, purchasing of tender document, bid security, etc., please visit Tender section of our website (URL: https://www.tatapower.com/tender/tender/itst.aspx). Eligible parties willing to participate may submit their expression of interest along with the tender fee on or before 20th June 2024.



TATA POWER The Tata Power Company Limited (Mundra Thermal Power Station - UMPP) Tunda Vandh Road, Tunda Village, Mundra, Kutch, Gujarat Reg. Office: Bombay House, 24 Homi Modi Street, Mumbai – 400 001

NOTICE INVITING EXPRESSION OF INTEREST

The Tata Power Company Limited hereby invites Expression of Interest (EOI) from eligible bidders for the following requirement for 4150 MW UMPP Mundra Thermal Power Station: 1. Outline Agreement of Explosion Vent for Hot Air Duct (Ref.: MTPS24MD_1000064608) For pregualification requirements, tender fee, bid security etc., please visit Tender section o our website (URL: https://www.tatapower.com/tender/tenderlist.aspx) and refer detailed Tender Notice for subject tender. Eligible bidders willing to participate in this tender may submit their Expression of Interest along with the Tender Fee and required documents latest by 30/06/2024.

Adani's Australia coal port gets \$333 m in private credit



FUELLING GROWTH. The proceeds of the private loan are to be used to refinance existing debt REUTERS

Bloomberg

The Adani Group unit that controls a major Australian coal port has obtained a private credit loan of about \$333 million, according to people familiar with the

pany, North Queensland Export Terminal, got the loan from Farallon Capital Management and King Street Cap-Management. Spokespeople at an Australian Adani group company, Farallon and King Street declined to

Sources said that the com-

SHIFTING LANDSCAPE

comment.

Australian coal-related companies are increasingly turning to higher interest-rate private loans as banks globally have become more reluctant about providing financing to commodity-related compan-

ies due to ESG concerns. Sydney-based coal miner Whitehaven Coal earlier this year secured a \$1.1 billion loan to buy two mines, attracting

17 private credit lenders and only one bank, while a consortium led by Golden Energy and Resource, controlled by Indonesia's Widjaja family, has also sounded out direct

The proceeds of the private loan obtained by Adani's North Queensland Export Terminal are to be used to refinance existing debt, according to sources.

North Queensland Export Terminal is a part of Bravus Australia, an Adani Group company which runs integrated energy and infrastructure services in Australia. North Queensland Export Terminal acquired a 99-year leasehold operation of the terminal from a Queensland Government entity in June 2011.

China urges EU to reconsider EV tariffs

Reuters

Beijing hopes the European Union will reconsider tariffs on Chinese electric vehicles and stop going further in the "wrong direction" to shield its auto industry from competition, according to official state news agency Xinhua.

China said it would take measures to safeguard its after European Commission announced on Wednesday it would impose extra duties of up to 38.1 per cent on imported Chinese electric cars from July.

TRADE SPAT

"In light of their economic structure and sheer size, China and the EU are best served by teaming up on major economic and trade Xinhua said, issues," adding: "It would be more cost-effective for the EU to araw on China's advantages in order to develop its own EV industry."

Less than a month after Washington revealed plans to quadruple duties for Chinese EVs to 100 per cent, Brussels said it also would combat Chinese subsidies with additional tariffs ranging from 17.4 per cent for BYD to 38.1 per cent for SAIC, on top of the standard 10 per cent car duty.

That takes the highest overall rate to nearly 50 per

BYD'S BULL RUN. The Chinese EV giant defied EU tariff jolt as

its Hong Kong-listed shares surged more than 7% in a day

Chinese EV car maker stocks mostly shrugged off the news, which was expected. The Hong Kong-listed shares of BYD surged more than 7 per cent in early trade, on track for their biggest one-day percentage gain since November 2022. "The EU tariff hike result

is slightly positive for BYD compared to our previous tariff expectation of 30 per cent, which improves BYD's export growth visibility into 2Q/3Q24. BYD's EU tariff is lower than other China players, which bodes well for its market share gain in EU," Citi said in a research

Geely Auto climbed 2.5 per cent, Xpeng rose more than 2 per cent, while Nio jumped 3.5 per cent.Leap Motor surged 4.4 per cent and Great Wall Motor's Hong Kong shares rose 0.4 per cent.

In contrast, shares in some of Europe's biggest carmakers — which make a big portion of their sales in China — fell on Wednesday due to fears of Chinese retaliation.

While European automakers are being cnailenged by an influx of EVs from lower-cost Chinese rivals, there is virtually no support for tariffs from the continent's auto industry. German automakers in particular are heavily dependent on sales in China and fear retribution from Beijing. European auto firms also import their Chinese-made vehicles.

US oil trade group to sue to block Biden's EV push

The nation's largest oil trade group, which includes Exxon Mobil and Chevron, will file a federal lawsuit on Thursday seeking to block the Biden administration's efforts to reduce planetwarming emissions from cars and light trucks and encourage electric vehicle manufacturing, the group

The US Environmental Protection Agency issued new tailpipe emission rules in March that will force the nation's automakers to produce and sell more electric vehicles to meet the new standards. Under the rule, the administration projects up to 56 per cent of all car sales will be electric between 2030 and 2032. The American Petroleum Institute (API) says the EPA has exceeded its congressional authority with a regulation that will eliminate most new gas cars and traditional hybrids from the US market in less than a decade.

The National Corn Growers Association and the American Farm Bureau Federation will join API as copetitioners. The two groups rely on gas-powered cars to support the corn-ethanol

GHCL Limited

Registered Office: GHCL House, Opp. Punjabi Hall, Navrangpura, Ahmedabad-380009 (Gujarat) Phone: 079-26427519. (CIN: L24100GJ1983PLC006513) Corporate Office: GHCL House, B-38, Institutional Area, Sector-1, Noida (UP). Ph. 0120-4939900.

Email: ghclinfo@ghcl.co.in; secretarial@ghcl.co.in; Website: www.ghcl.co.in NOTICE OF 41ST ANNUAL GENERAL MEETING AND REMOTE E-VOTING INFORMATION

In continuation of our previous advertisement published on May 27, 2024, we hereby issue a NOTICE to inform you that 41st Annual General Meeting of the members of GHCL Limited (CIN: L24100GJ1983PLC006513) will be held on Monday, July 8, 2024 (सोमवार, आषाढ़, शुक्ल पक्ष – तृतीया, विक्रम संवत २०८१) at 10:00 a.m. (IST) via video conference (VC) and other audio visual means (OAVM).

In accordance with the circulars issued by the Ministry of Corporate Affairs (MCA) and the Securities and Exchange Board of India (SEBI), companies are permitted to conduct AGMs through VC / OAVM without the physical presence of members at a common venue. Therefore, our Company has opted to hold the AGM via VC to discuss and transact the business outlined in the Notice of AGM dated May 6, 2024.

In compliance with the circulars, we have electronically sent the notice of the 41st AGM and the Integrated Annual Report of our Company for the financial year 2023-24 to all members whose email addresses are registered with the Company or Depository Participants. These documents are also accessible on our company's website (www.ghcl.co.in), as well as on the websites of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com), and CDSL (www.evotingindia.com). The dispatch of the AGM notice via email was completed on June 13, 2024.

As per the cut-off date, which is July 1, 2024 (Monday), the voting rights of members will be determined based on their shares of the paid-up equity share capital of the Company. To facilitate the voting process, Central Depository Services Limited (CDSL) will provide the option for members to cast their votes through an electronic voting system known as "remote e-voting." The Notice of the AGM includes information on the process and procedure for remote e-voting, as well as instructions for participating in the AGM through video conference. The remote e-voting period for the 41st AGM will commence at 9.00 am (IST) on Wednesday, July 3, 2024 and ends

votes on the agenda items specified in the Notice. The e-voting module will be disabled after the voting period ends and no further changes to the cast votes will be allowed. Additionally, members attending the meeting will have the option to vote through the electronic voting system during the AGM. Those who have already cast their votes through remote e-voting will be able to attend the meeting but will not be eligible to vote again. Detailed instructions for members regarding remote e-voting were provided in the

at 5:00 p.m. (IST) on Sunday, July 7, 2024. During this period, members of the Company may electronically cast their

AGM Notice and the newspaper advertisement published on May 27, 2024. If you have any queries or issues regarding e-voting, we have provided resources to assist you. You can refer to the Frequently Asked Questions (FAQs) and e-voting manual available at www.evotingindia.com under the help section Additionally, you can reach out for support by sending an email to <u>helpdesk.evoting@cdslindia.com</u> or by calling 1800225533. Alternatively, you may contact the concerned employees of CDSL at 022-23058543 / 23058542 between 10:00 a.m. to 6:30 p.m. from Monday to Friday.

For any grievances related to electronic voting, you can contact to Mr. Ganapati Haligouda, C-101, 247 Park, L.B.S. Marg, Vikhroli (W), Mumbai-400083, Tel. 8108116767, Fax: 022-49186060, Email: rnt.helpdesk@linkintime.co.in. We kindly request that you send your queries at least seven days in advance of the meeting to ensure that the information can be made available and addressed during the meeting.

Your engagement and participation are highly valued, and we are here to provide assistance and support throughout the e-voting process.

Place : Noida Date : June 13, 2024 For GHCL Limited Bhuwneshwar Mishra VP - Sustainability & Company Secretary

\mathfrak{Q} GHCL

Date : June 13, 2024

GHCL Textiles Limited

Registered Office: GHCL House, Opp. Punjabi Hall, Navrangpura, Ahmedabad-380009 (Gujarat). **Phone**: 079-26427519. (**CIN**: L18101GJ2020PLC114004) Corporate Office: GHCL House, B-38, Institutional Area, Sector-1, Noida (UP) - 201301. Phone: 0120-4939900. Email: secretarial@ghcl.co.in: Website: www.ghcltextiles.co.in

NOTICE OF 4TH ANNUAL GENERAL MEETING AND REMOTE E-VOTING INFORMATION In continuation of our previous advertisement published on May 27,2024, we hereby issue a NOTICE to inform you that the 4th Annual General Meeting (AGM) of the Company will be held on Monday, July 08, 2024 (सोमवार, आषाढ, शुक्ल पक्ष – तृतीया, विक्रम संवत २०८१) at **12.30 P.M.** (IST) through Video Conferencing (VC) or Other Audio-Visual Means (OAVM).

In accordance with the circulars issued by the Ministry of Corporate Affairs (MCA) and the Securities and Exchange Board of India (SEBI), companies are permitted to conduct AGMs through VC/ OAVM without the physical presence of members at a common venue. Therefore, our Company has opted to hold the AGM via VC to discuss and transact the business outlined in the Notice of AGM dated May 06,2024. In compliance with the circulars, we have electronically sent the notice of the 4th AGM and the Annual Report of the

Company for the financial year 2023-24 to all the members whose email addresses are registered with the Company

or Depository Participants. These documents are also accessible on our company's website (www.ghcltextiles.co.in), as well as on the websites of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com), and CDSL (www.evotingindia.com). The dispatch of the AGM notice via email was completed As per the cut-off date, which is July 01, 2024 (Monday), the voting rights of the members will be determined

based on their shares in the paid-up equity share capital of the Company. To facilitate the voting process, Central Depository Services Limited (CDSL) will provide the option for members to cast their votes through an electronic voting system, known as "remote e-voting." The Notice of the AGM includes information on the process and procedure for remote e-voting, as well as instructions for participating in the AGM through video conference.

The remote e-voting period for the 4th AGM will commence on Wednesday, July 03, 2024 at 9:00 a.m. (IST) and ends on Sunday, July 07, 2024 at 5:00 p.m. (IST). During this period, members of the Company may electronically cast their votes on the agenda items specified in the Notice. The e-voting module will be disabled after the voting period ends, and no further changes to the cast votes will be allowed.

Additionally, members attending the meeting will have the option to vote through the electronic voting system during the AGM. Those who have already cast their votes through remote e-voting will be able to attend the meeting but will not be eligible to vote again. Detailed instructions for members regarding remote e-voting were provided in the AGM Notice and the newspaper advertisement published in this regard. If you have any queries or issues regarding e-voting, we have provided resources to assist you. You can refer to the

Frequently Asked Questions (FAQs) and e-voting manual available at www.evotingindia.com under the help section. Additionally, you can reach out for support by sending an email to helpdesk.evoting@cdslindia.com or by calling 1800225533. Alternatively, you may contact the concerned employees of CDSL at 022-23058543 / 23058542 between 10:00 a.m. to 6:30 p.m. from Monday to Friday.

For any grievances related to electronic voting, you can contact to Mr. Ganapati Haligouda at rnt.helpdesk@linkintime.co.in or reach out to Link Intime India Private Limited at the following address: C-101, 247 Park, L. B. S. Marg, Vikhroli (West) Mumbai - 400083, Tel: 022-49186000.

We kindly request that you send your queries at least seven days in advance of the meeting to ensure that the information can be made available and addressed during the meeting.

Your engagement and participation are highly valued, and we are here to provide assistance and support throughout the e-voting process. For GHCL Textiles Limited

Lalit Narayan Dwivedi Company Secretary (Membership No. F10487)